



ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

“રાજીવ ગાંધી ભવન”, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬.

ફોન : (૦૭૯) ૨૬૫૭૮૨૧૨, ૨૬૫૭૮૨૧૩ ફેક્સ : (૦૭૯) ૨૬૫૭૮૫૮૯

website : www.incgujarat.com • E-mail : gpcc1234@gmail.com

અખબારી યાદી

તા. ૦૮-૦૭-૨૦૨૬

‘ડિજિટલ ઈન્ડિયા’ની ગુલબાંગો વચ્ચે પોસ્ટ ઓફિસના વહીવટી તંત્રનું દેવાળું:
છેલ્લા ૨ મહિનાથી પાસબુક અને FD બુક ગાયબ, લાખો રોકાણકારો રઝબ્યા!

- લાખોના રોકાણ સામે પુરાવા તરીકે માત્ર સિફ્ટો મારેલી કાપલી : હેમાંગ રાવલ
- સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગની મૂડી ભગવાન ભરોસે : હેમાંગ રાવલ
- નવા એકાઉન્ટ કે નવી FD ખોલાવનારને પણ કોઈ સત્તાવાર દસ્તાવેજ કે પાસબુક અપાતી નથી. : હેમાંગ રાવલ
- સામાન્ય જનતાનો પોસ્ટ ઓફિસ પરથી વિશ્વાસ ઉઠાડીને તેમને ખાનગી બેન્કો તરફ ધકેલવાનું આયોજનબદ્ધ ષડયંત્ર? : હેમાંગ રાવલ
- સરકારની સંવેદનહીનતાની પરાકાષ્ઠા: પરસેવાની કમાણીની સુરક્ષા એ સરકારની જવાબદારી છે, કોઈ મોટું કૌભાંડ થાય તે પહેલા તંત્ર સત્વરે પોતાની ફરજ નિભાવે : હેમાંગ રાવલ

એક તરફ સરકાર ‘ડિજિટલ ઈન્ડિયા’, ‘સુશાસન’ અને ‘વિશ્વગુરુ’ બનવાના મોટા મોટા દાવાઓ કરીને કરોડો રૂપિયાની જાહેરાતો પાછળ પોતાની પીઠ થાબડી રહી છે, તો બીજી તરફ વરવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં વહીવટી તંત્રનું સંપૂર્ણ દેવાળું ફૂંકાઈ ગયું છે. છેલ્લા બે મહિનાથી પાસબુક, FD બુક અને અન્ય સ્ટેશનરી સંપૂર્ણપણે ખલાસ થઈ ગઈ છે. ગુજરાતમાં અંદાજે ૮,૦૦૦ જેટલી પોસ્ટ ઓફિસો આવેલી છે, જેમાંથી ૮,૦૦૦ જેટલી પોસ્ટ ઓફિસો છેવાડાના ગામડાઓમાં અને ૧,૦૦૦ જેટલી શહેરોમાં છે. આ પોસ્ટ ઓફિસો મારફતે ગુજરાતમાં અંદાજે ૨ થી ૨.૫ કરોડ જેટલા વિવિધ બચત ખાતાઓનું સંચાલન થાય છે. આટલા વિશાળ પાયે લોકોની પરસેવાની કમાણી જમા થતી હોય, ત્યારે ૨ મહિના સુધી પાસબુક જ ઉપલબ્ધ ન હોવી એ સરકારની ધોર બેદરકારી અને કરોડો ખાતેદારોના નાણાં સાથે ચેડાં કરવા સમાન છે.

હાલત એટલી હદે કથળી ગઈ છે કે પોસ્ટ ઓફિસની તમામ નાણાકીય સેવાઓ (Financial Services) માટે જરૂરી પાસબુક કે સર્ટિફિકેટનું પ્રિન્ટિંગ જ બંધ છે. આ સેવાઓમાં

સામાન્ય બચત ખાતા (Savings Account),	રિકરિંગ ડિપોઝિટ (RD)	ફિક્સ ડિપોઝિટ (TD)
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)	માસિક આવક યોજના (MIS)	સુકન્યા સમૃદ્ધિ યોજના (SSA)
મહિલા સન્માન બચત પત્ર (MSSC)	પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)	કિસાન વિકાસ પત્ર (KVP)
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)	પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI)	

સહિતની તમામ યોજનાઓનો સમાવેશ થાય છે.

જો કોઈ નાગરિક પોતાના હકના પૈસા જમા કરાવવા જાય અને તેની જૂની પાસબુક ભરાઈ ગઈ હોય, તો તેને નવી પાસબુક આપવામાં આવતી નથી. નવા ખાતા ખોલાવનાર કે નવી FD કરાવનારને પણ કોઈ જ બુક અપાતી નથી. રોકાણકારો પોતાના હજારો-લાખો રૂપિયા જમા કરાવે ત્યારે પુરાવા તરીકે માત્ર પૈસા ભર્યાની સ્લીપ (Pay-in-slip) પર એક રબર સ્ટેમ્પ (સિક્કો) મારીને પકડાવી દેવામાં આવે છે! કાગળની આ કાપલીઓ લોકો ક્યાં સુધી અને કેવી રીતે સાચવશે? જ્યારે સિસ્ટમમાં કે પાસબુકમાં પૈસા જમા થયાની કોઈ પ્રિન્ટેડ એન્ટ્રી કે સ્ટેટમેન્ટ જ ન મળતું હોય, ત્યારે ભવિષ્યમાં પોસ્ટ ઓફિસોમાં મોટાપાયે ગેરનીતિ અને કરોડો રૂપિયાના જંગી કૌભાંડ થવાની પૂરેપૂરી સંભાવના છે.

સરકારના આ વહીવટી તંત્રના બેવડા માપદંડો તો જુઓ! એક તરફ જો કોઈ ખાતેદારની પાસબુક કે સર્ટિફિકેટ ખોવાઈ જાય, ફાટી જાય કે બગડી જાય, તો ડુપ્લિકેટ પાસબુક મેળવવા માટે તેને ખૂબ જ લાંબી અને ત્રાસદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ખાતેદારે ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ (સોગંદનામું) કરાવવું પડે છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાવવી પડે છે. પરંતુ આટલી લાંબી કાયદાકીય માથાફૂટ અને ખર્ચ કર્યા પછી જ્યારે સામાન્ય માણસ નવી પાસબુક લેવા પોસ્ટ ઓફિસે પહોંચે છે, ત્યારે તેને એવો શરમજનક જવાબ મળે છે કે 'સ્ટેશનરી જ અવેલેબલ નથી!' એક તરફ તંત્ર સામાન્ય જનતાને નિયમોના નામે પીસે છે, અને બીજી તરફ પોતાની જ પ્રાથમિક ફરજ બજાવવામાં સાવ નિષ્ફળ નીવડ્યું છે.

મોટા ઉત્સવો અને તાલુકાઓ પાછળ કરોડો રૂપિયા ઉડાડતી સરકારને કોંગ્રેસનો સીધો સવાલ છે કે, સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોના ભરેલા નાણાની સુરક્ષા શું? તેની સાબિતી શું? પેન્શનરો અને વડીલો પોતાની આર્થિક સુરક્ષા માટે ખાનગી બેંકોના જોખમથી બચીને પોસ્ટ ઓફિસ પર ભરોસો કરે છે. પરંતુ આજે પોતાનું જમા ખાતું ચેક કરવા માટે કોઈ આધાર ન હોવાથી તેઓ અસલામતી અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. શું સરકારી બાબુઓ અને નેતાઓની મિલીભગતથી સામાન્ય જનતાનો પોસ્ટ ઓફિસ પરથી વિશ્વાસ ઉઠાડીને તેમને ખાનગી બેંકો તરફ ધકેલવાનું આ કોઈ આયોજનબદ્ધ ષડયંત્ર છે?

સામાન્ય જનતા અને વડીલોની મૂડીની સુરક્ષા કરવી એ સરકાર અને ટપાલ વિભાગની નૈતિક અને બંધારણીય જવાબદારી છે. બે મહિનાથી આટલો મોટો પ્રશ્ન હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી, જે તેમની સંવેદનહીનતાની પરાકાષ્ટા દર્શાવે છે. અમારી અત્યંત કડક શબ્દોમાં માંગ છે કે સરકાર અને પોસ્ટલ વિભાગ તાત્કાલિક ધોર નિંદ્રામાંથી જાગે અને પોતાની જવાબદારીનું સત્વરે વહન કરે. યુદ્ધના ધોરણે પાસબુકો અને FD ની ચોપડીઓનો જથ્થો પૂરો પાડવામાં આવે, અન્યથા પ્રજાના નાણાં સાથે થતા કોઈપણ ચેડાં કે હાલાકી માટે સંપૂર્ણપણે સરકાર જ જવાબદાર ઠરશે..



હેમાંંગ મહિપતરામ રાવલ
મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા,
મો. ૯૮૯૮૨૩૩૦૩૮